

Seat No. : _____

TC-08

Advanced Accountancy & Auditing Paper IV

Time : 3 Hours]

[Total Marks : 70

- સૂચના : (1) કૌંસમાં આપેલ સંખ્યા પ્રશ્નના ગુણ દર્શાવે છે.
(2) તમારા ઉત્તરના ભાગરૂપે તમારી ગણતરીને દર્શાવો.

1. AB કંપની લિમિટેડ તમને પ્રક્રિયા નં. 3 ને લગતી ફેબ્રુઆરી 2005 ના મહિનાની નીચેની માહિતી પૂરી પાડે છે. તે પરથી પ્રક્રિયા નં. 3 નું ખાતુ બનાવો. 14

	રૂ.
● પ્રક્રિયા નં. 3 માં શરૂઆતનો સ્ટોક 2000 એકમો	28,800
● પ્રક્રિયા નં. 2 માંથી લાવ્યા 85,200 એકમો	6,61,600
● પ્રક્રિયા નં. 3 માં દાખલ કરેલ પ્રત્યક્ષ માલસામાન	3,21,440
● પ્રત્યક્ષ મજૂરી	1,58,480
● કારખાનાના પરોક્ષ ખર્ચ	79,240
● ભંગારમાં કાઢી નાખેલ એકમો	4,400 એકમો
● પ્રક્રિયા નં. 4 ખાતે લઈ ગયેલ એકમો	75,600 એકમો
● પ્રક્રિયા નં. 3 નો આખરનો સ્ટોક	7,200 એકમો

પૂર્ણતાની કક્ષા :

	શરૂઆતનો સ્ટોક	આખરનો સ્ટોક	ભંગાર
માલસામાન	70 %	80 %	100 %
મજૂરી	50 %	60 %	80 %
કારખાનાના પરોક્ષ ખર્ચ	50 %	60 %	80 %

પ્રક્રિયામાં સામાન્ય બગાડ ઉત્પાદનના 5% હતો અને ભંગાર એકમ દીઠ રૂ. 3 લેખે વેચવામાં આવે છે. કંપની ફિફો (FIFO) પદ્ધતિ અનુસરે છે.

(જરૂરી બધીજ ગણતરી દર્શાવો.)

અથવા

- (અ) જુદાં જુદાં અંદાજપત્રો તૈયાર કરવા માટે ધ્યાનમાં રાખવાના પરિબળો ટૂંકમાં સમજાવો. 7

(બ) રાજેન્દ્ર લિમિટેડ 30-6-2005 ના રોજ પૂરા થતા ત્રણમાસ માટેનું વેચાણ બજેટ બનાવવા માંગે છે. તે તમને નીચેની માહિતી આપે છે. 7

(i) વેચાણનું પ્રમાણ નીચે મુજબ છે.

વિસ્તાર	વસ્તુ X (એકમો)	વસ્તુ X (એકમો)	વસ્તુ Y (એકમો)	વસ્તુ Y (એકમો)
A	60 %	60 %	30 %	30 %
B	15 %	15 %	40 %	40 %
C	25 %	25 %	30 %	30 %

(ii) વેચાણ કિંમત એકમ દીઠ રૂ. 12 રૂ. 18

50 % વેચાણ રોકડેથી થાય છે અને ઉધાર વેચાણના નાણા બીજે મહિને મળે છે.

(iii) માર્ચ 2005 ના મહિના દરમિયાન રૂ. 70,000 નું વેચાણ થયેલ છે અને ચાર માસના વેચાણનો અંદાજ નીચે પ્રમાણે છે. (એકમમાં)

	વસ્તુ X	વસ્તુ Y
એપ્રિલ 2005	1,500	3,000
મે 2005	1,700	3,200
જૂન 2005	2,000	3,600
જુલાઈ 2005	2,250	3,800

2. આનંદ એન્ડ કંપની એક વસ્તુનું ઉત્પાદન કરે છે તે ત્રણ પ્રક્રિયામાંથી પસાર થાય છે. તેની ફેબ્રુઆરી 2005 દરમિયાનના ઉત્પાદનને લગતી માહિતી નીચે મુજબ છે. 14

વિગત	પ્રક્રિયા I રૂ.	પ્રક્રિયા II રૂ.	પ્રક્રિયા III રૂ.	તૈયાર માલ રૂ.
શરૂઆતનો સ્ટોક	40,000	48,000	32,000	1,20,000
પ્રત્યક્ષ માલસામાન	80,000	84,000	1,20,000	—
પ્રત્યક્ષ મજૂરી	60,000	60,000	64,000	—
ઉત્પાદનના શિરોપરી ખર્ચા	56,000	24,000	1,60,000	—
આખર સ્ટોક	20,000	24,000	16,000	60,000
દરેક પ્રક્રિયા પર પડતર ઉપર નફો	33 1/3 %	25 %	25 %	—
શરૂઆતના સ્ટોક પર આંતર પ્રક્રિયા નફો	—	8,000	8,000	44,000

દરેક પ્રક્રિયાનો સ્ટોક પ્રાથમિક પડતરને ધોરણે આંકવામાં આવે છે અને તૈયાર માલનો સ્ટોક જે કિંમતે તે પ્રક્રિયા III માંથી મળે છે તે કિંમતે જ આંકવામાં આવે છે. તે સમય દરમિયાન વેચાણ રૂ. 14,00,000 નું થયું હતું.

નીચે મુજબ તૈયાર કરો અને ગણતરી કરો

- (a) દરેક તબક્કે નફો દર્શાવતાં પ્રક્રિયા ખાતા.
- (b) ખરેખર મળેલ નફાનું પત્રક.
- (c) પાકા સરવૈયાના હેતુ માટે સ્ટોકનું મૂલ્ય.

અથવા

2. (અ) “સમાન પડતર પદ્ધતિનો ઉપયોગ કોઈ એક ઉદ્યોગમાં શક્ય નથી” તમે આ વિધાન સાથે સંમત છો ? વિગતવાર ચર્ચા કરો. 7
- (બ) નીચેની માહિતી પરથી 30 જૂન 2005 ના રોજ પૂરા થતા ત્રણમાસ માટેનું રોકડ અંદાજપત્ર બનાવો. 7

- 1 એપ્રિલ 2005 ના રોજ રોકડ અને બેંક સિલક રૂ. 75,000
- અંદાજેલ માસિક પગાર અને મજૂરી 30,000
- ચૂકવવાપાત્ર વ્યાજ, મે 2005 15,000

અંદાજ

	માર્ચ	એપ્રિલ	મે	જૂન
	રૂ.	રૂ.	રૂ.	રૂ.
રોકડ વેચાણ	ખરેખર	4,20,000	4,56,000	3,63,000
ઉધાર વેચાણ	3,00,000	2,40,000	4,20,000	3,60,000
ખરીદી	4,80,000	5,10,000	7,20,000	5,40,000
અન્ય ખર્ચા	–	60,000	66,000	63,000

ઉધાર વેચાણના નાણા પૈકી 50 % રકમ જે મહિને વેચાણ થયું હોય તે મહિને મળે છે અને બાકીની 50% રકમ બીજે મહિને મળે છે. ઉધાર વેચાણની ઉઘરાણી પર જો તેજ માસમાં નાણા મળે તો 5 % વટાવ આપવામાં આવે છે અને બીજા મહિને નાણા મળે તો 2.5 % વટાવ મળે છે.

લેણદારોને તરતજ નાણા ચૂકવાય છે અથવા 30 દિવસમાં નાણા ચૂકવાય છે. એવો અંદાજ છે કે 10% જેટલા લેણદારોને તાત્કાલિક નાણા ચૂકવવા પડે છે.

3. (અ) એક કંપનીના ઉત્પાદન મિશ્ર અંગેની માહિતી નીચે મુજબ છે. 10

વિગત	વસ્તુ		
	અ	બ	ક
એકમદીઠ કાર્યોમાલ	10 કિલો	6 કિલો	15 કિલો
મજૂરીના કલાક (દર રૂ. 1 પ્રતિ કલાક)	15	25	20
એકમદીઠ વેચાણ કિંમત	125	100	200
મહત્તમ શક્ય ઉત્પાદનના એકમો	6,000	4,000	3,000

1,00,000 કિલોનો કાચોમાલ રૂ. 10 લેખે ઉપલબ્ધ છે.

ઉપરની માહિતીના આધારે મહત્તમ નફો મેળવવા માટે દરેક વસ્તુના કેટલા એકમોનું ઉત્પાદન કરવું જોઈએ તે જણાવો.

(બ) ઉર્મા ઓટોમોબાઈલ્સ લિમિટેડ ના ચોપડામાંથી નીચેની માહિતી મળેલ છે. 4

	2003	2004
	રૂ.	રૂ.
વેચાણ	80,000	90,000
નફો	10,000	14,000

ઉપરની વિગતો પરથી (i) નફા જથ્થાનો ગુણોત્તર અને

(ii) રૂ. 60,000 નું વેચાણ હોય તો સલામતીનો ગાળો શોધો.

અથવા

3. કેમીકલ X ના એક ટન માટે પ્રમાણિત મિશ્રણ અંગેની વિગતો નીચે મુજબ છે. 14

કેમીકલ	વપરાશ Kgs	કિલો દીઠ પડતર રૂ.
A	240	6
B	400	12
C	640	10

એકમાસ દરમિયાન 6.25 ટનનું ઉત્પાદન થયેલ છે. જેની માહિતી નીચે પ્રમાણે છે.

કેમીકલ	વપરાશ (ટનમાં)	પડતર રૂ.
A	1.6	11,200
B	2.4	30,000
C	4.5	47,250

નીચેના વિચલનોની ગણતરી કરો.

- (i) માલ સામાન ખર્ચ વિચલન
- (ii) માલ સામાન ભાવ વિચલન
- (iii) માલ સામાન વપરાશ વિચલન
- (iv) માલ સામાન મિશ્રણ વિચલન
- (v) માલ સામાન પેટા-વપરાશ વિચલન

4. માગ્યા પ્રમાણે જવાબ લખો.

- (a) સંચાલકીય હિસાબી પદ્ધતિની મુખ્ય પદ્ધતિઓ જણાવો. 3
- (b) વિવિધ નાણાકીય પત્રકો તૈયાર કરવાના હેતુઓ જણાવો. 3

- (c) મીના લીમીટેડ કંપનીના ગુણોત્તરો અને આદર્શ ગણાવી શકાય એવા ગુણોત્તર આપ્યા છે. 8
તેને આધારે કંપનીની પરિસ્થિતિ પર ટીકાત્મક નોંધ લખો.

વિગત	કંપનીનો ગુણોત્તર	આદર્શ ગુણોત્તર
1. ચાલુ ગુણોત્તર	4 : 1	2 : 1
2. માલિકી ગુણોત્તર	60 %	70 %
3. કાચા નફાનો ગુણોત્તર	40 %	40 %
4. દેવાદાર ગુણોત્તર (Velocity)	35 દિવસ	45 દિવસ

અથવા

4. (અ) નફાનુકસાન ખાતા પરથી અને પાકા સરવૈયા પરથી ઉદ્ભવતા 4
(i) રોકાયેલ મૂડી પર વળતરનો ગુણોત્તર અને (ii) લેણદાર ગુણોત્તરના સુત્ર લખી ઉદાહરણ સાથે સમજાવો.
- (બ) દેવલ લીમીટેડના પાકા સરવૈયા નીચે મુજબ છે. 10

દેવાં	2003-04 રૂ.	2002-03 રૂ.	મિલકતો	2003-04 રૂ.	2002-03 રૂ.
ઈક્વિટી શેર મૂડી	7,50,000	6,00,000	મકાન	7,50,000	4,50,000
10% ની પ્રેફરન્સ-શેર મૂડી	3,00,000	3,00,000	યંત્રો	1,50,000	3,00,000
અનામત ભંડોળ	2,73,000	2,43,000	ફર્નિચર	1,50,000	1,50,000
15% ના ડિબેન્ચર	3,00,000	3,00,000	સ્ટોક	2,25,000	1,50,000
લેણદારો	30,000	24,000	દેવાદારો	3,75,000	4,50,000
પ્રોવિડન્ટ ફંડ	30,000	36,000	લેણી હૂંડીઓ	45,000	30,000
કરવેરાની જોગવાઈ	15,000	30,000	રોકડ અને		
બેંક ઓવરડ્રાફ્ટ	75,000	60,000	બેંક સિલક	75,000	60,000
			પ્રાથમિક ખર્ચા	3,000	3,000
	17,73,000	15,93,000		17,73,000	15,93,000

વધારાની માહિતી :

	2003-04 રૂ.	2002-03 રૂ.
● કુલ વેચાણ (રોકડ વેચાણ ઉધાર વેચાણનો 3/5 ભાગ છે.)	18,75,000	15,00,000
● કાચો નફો	4,50,000	3,00,000
● વ્યાજ અને કરવેરા પહેલાંનો ચોખ્ખો નફો	4,65,000	4,05,000
● કરવેરા દર 50 % ધારો		
● શરૂઆતનો સ્ટોક (1-4-2002)		90,000

ઉપરની માહિતી પરથી નીચેના ગુણોત્તરોની ગણતરી કરો અને તેનું અર્થઘટન કરો.

- (i) ચોખ્ખા નફાનો ગુણોત્તર.
- (ii) સ્ટોક ગુણોત્તર (સ્ટોક ચલન દર).
- (iii) પ્રવાહી ગુણોત્તર.

5. (અ) રાઈઝીંગ સ્ટાર લિમિટેડના વર્ષ ૨૦૦૪ અને ૨૦૦૩ ના પાકા સરવૈયા નીચે મુજબ આપેલા છે તે પરથી રોકડ પ્રવાહ પત્રક ૩૧.૩.૨૦૦૪ ના રોજ પૂરા થતા વર્ષ માટે રોકડ પ્રવાહ પત્રક તૈયાર કરો.

14

વિગત	31-3-2004 રૂ.	31-3-2003 રૂ.
જવાબદારીઓ :		
ઈક્વીટી શેરમૂડી	60,000	50,000
10 % ની રીડીમેબલ પ્રેફરન્સ શેરમૂડી	—	20,000
મૂડી પરત અનામત	10,000	—
મૂડી અનામત	10,000	—
સામાન્ય અનામત	10,000	25,000
નફાનુકસાન ખાતું	7,000	5,000
9% ના ડિબેન્ચર	20,000	—
પરચૂરણ લેણદારો	9,500	8,000
દેવી હૂંડી	2,000	3,000
ચૂકવવાના બાકી ખર્ચા	3,000	2,000
કરવેરાની જોગવાઈ	9,500	6,000
સૂચિત ડિવીડન્ડ	9,000	6,000
	1,50,000	1,25,000
મિલકતો :		
જમીન અને મકાન	15,000	20,000
સાંચા અને યંત્રો	76,500	50,000
રોકાણો	5,000	8,000
ઈન્વેન્ટરી (સ્ટોક)	9,500	9,000
લેણીહૂંડી	6,500	7,000
પરચૂરણ દેવાદારો	17,500	13,000
રોકડ અને બેન્ક	6,500	9,000
પ્રાથમિક ખર્ચા	1,000	2,500
સ્વૈચ્છિક નિવૃત્તી અંગેની ચૂકવણી	12,500	6,500
	1,50,000	1,25,000

વધારાની માહિતી :

- (i) જમીનનો એક ટૂકડો જેની કિંમત રૂ. 12,000 હતી તે રૂ. 15,000 માં વેચેલ છે અને બાકીની જમીનનું પુનઃ મૂલ્યાંકન કરેલ છે. જમીન વેચાણનો નફો અને પુનઃ મૂલ્યાંકનનો નફો મૂડી અનામત ખાતે લઈ ગયા છે.
- (ii) 1-4-2003 ના રોજ રૂ. 7,000 ની પડતર કિંમતનું યંત્ર કે જેની ઘટતી જતી બાકી (W.D.V.) રૂ. 5,000 તે રૂ. 9,000 માં વેચેલ છે, અને રૂ. 45,000 ના નવા યંત્રો ખરીદ્યા હતા તેના અવેજ પેટે રૂ. 10,000 ના ડિબેચર આપેલ છે.
- (iii) રૂ. 5,000 ની કિંમતના રોકાણો રૂ. 7,000 માં વેચેલ છે.
- (iv) રોકાણોની ખરીદી પહેલાનું ડિવીડન્ડ રૂ. 500 મળેલ છે જે રોકાણની પડતર સામે માંડી વાળેલ છે.
- (v) ડિરેક્ટરોએ ચાલુ વર્ષે 15 % ડિવીડન્ડની ભલામણ કરેલ છે.
- (vi) સ્વૈચ્છિક નિવૃત્તિ અંગેની રૂ. 5,000 ની ચૂકવણી સામાન્ય અનામત ખાતે માંડી વાળેલ છે.
- (vii) ચાલુ વર્ષ માટેની કરવેરાની જવાબદારી રૂ. 13,500 અંદાજેલ છે.
- (viii) સાંચા અને યંત્રો પર 15% લેખે ઘસારો માંડી વાળેલ છે. જ્યારે જમીન અને મકાન પર ઘસારો ગણેલ નથી.

અથવા

5. (i) નાણાકિય હિસાબો અને મેનેજમેન્ટ એકાઉન્ટસી **અથવા** રોકડ પ્રવાહ પત્રક અને ભંડોળ પ્રવાહ પત્રક વચ્ચેનો તફાવત સમજાવો. **14**
- (ii) નાણાકિય પત્રકોની મર્યાદાઓ વિશે નોંધ લખો.